

23 November 2017

To,
National Stock Exchange of India Limited
Exchange Plaza,
Plot No. C/1, 'G' Block,
Bandra- Kurla Complex,
Bandra ('E')
Mumbai 400 051

BSE Limited
Dept. DSC_CRD
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street
Bandra ('E')
Mumbai 400 001

Stock code No. **INEOSSTYRO**

Stock code No. **506222**

Subject: Publication of Notice in newspapers for transfer of equity shares to Investor Education and Protection Fund (IEPF).

Dear Sir,

Please find attached copies of notice regarding transfer of equity shares to IEPF belonging to those shareholders who have not claimed their Dividend for seven consecutive years from FY 2009-10 onwards informing them, amongst others, about the revised due date for such transfer, published in Business Standard, Ahmedabad Edition (English) and Vadodara Samachar, Vadodara Edition (Gujarati) in accordance with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Second Amendment Rules, 2017.

We request you to take the above information on your records.

Thanking you.

Yours Faithfully,
For **INEOS Styrolution India Limited**

Haresh Khilnani
Company Secretary, Head – Legal & Compliance

HB ESTATE DEVELOPERS LIMITED
 CIN: L9999HR1994PLC034146
 Registered Office: Plot No. 31, Echelon Institutional Area, Sector 32, Gurugram-122001, Haryana
 Ph. : + 91-124-4675500, Fax No. : + 91-124-4370985
 E-mail : corporate@hbestate.com, Website : www.hbestate.com

NOTICE
 (For the Attention of Equity Shareholders of the Company)

Compulsory Transfer of Equity Shares of the Company to DEMAT Account of the Investor Education and Protection Fund (IEPF) Authority

The Ministry of Corporate Affairs (MCA) had notified the "Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016" ("the said Rules") which have come into force from 07th September, 2016 providing for transfer of the Equity Shares in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more to the IEPF Authority.

The Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2017 and the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Second Amendment Rules, 2017 have been notified by MCA on 28th February, 2017 and 13th October, 2017 respectively ("the Amended Rules") providing for transfer of Equity Shares to the specified DEMAT Account of IEPF Authority. As per the Amended Rules, the due date for transfer of Equity Shares shall be deemed to be 31st October, 2017.

The Company had communicated individually the concerned Shareholders that all Shares in respect of which dividend has not been paid or claimed by them for seven consecutive years from the Financial Year 2008-09 onwards shall be transferred to IEPF Account. The Company had also published the Notices in the Business Standard (English & Hindi) Newspaper on 30th December, 2016 to that effect.

The Unpaid / Unclaimed Dividend for the Financial Year 2009-10 had also become due for transfer to IEPF Account and the same has been duly transferred to IEPF Account on 06th October, 2017. All Shares in respect of which dividend has not been paid or claimed for seven consecutive years from the Financial Year 2009-10 onwards shall simultaneously be transferred to Demat Account of IEPF Authority. The Company has sent Individual Intimation to the concerned Shareholders in this regard.

NOTICE IS HEREBY GIVEN THAT:

The Company will proceed to initiate action for transfer of all such Shares to the DEMAT Account of IEPF Authority within 30 days from the due date i.e. 31st October, 2017, without any further notice in this regard.

As per the Amended Rules, the concerned Shareholders holding the Shares in physical form and whose Shares are liable to be transferred to IEPF, may please note that the Company would be issuing new Share Certificate(s) in lieu of the Original Share Certificate(s) held by them for the purpose of conversion into DEMAT form and subsequent transfer in DEMAT Account opened by the IEPF Authority with NSDL and CDSL through Punjab National Bank and SBICAP Securities Limited respectively. Upon such issue, the Original Share Certificate(s) issued to the concerned Shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Further, the concerned Shareholders who are holding Shares in demat form, may please note that the transfer of Shares in DEMAT Account of the IEPF Authority as indicated hereinabove will be effected by the Company through the respective Depository by way of Corporate Action.

The Company has uploaded complete details of such Shares on its website, www.hbestate.com which shall be deemed to be adequate notice in respect of issue of new Share Certificate(s) by the Company for the purpose of transfer to DEMAT Account of IEPF Authority.

Any further Dividend on such Shares shall be credited to the IEPF Account. The concerned Shareholders may further note that upon credit of such Shares to the said DEMAT Account, no claim shall lie against the Company in respect of the Unclaimed Dividend amount and such Shares transferred to IEPF Account. However, Shareholders may claim back the Shares credited along with the Unclaimed Dividend amount from IEPF Authority after following the procedure prescribed under the IEPF Rules. The procedure for claiming the same is available at www.mca.gov.in and www.iepf.gov.in

In case the Shareholders have any queries, please feel free to contact Company's Registrar and Share Transfer Agent, RCMC Share Registry Pvt. Ltd., Mr. Ravindra Dua, Ph: 011-26387320; E-mail: rdua@rcmcdeli.com or the Company Secretary, Mrs. Radhika Khurana, Ph: 0124-4675500; E-mail: corporate@hbestate.com

For HB Estate Developers Limited
 Sd/-
 Radhika Khurana
 (Company Secretary)
 M. No. : 32557
 Date : 21.11.2017
 Place : Gurugram

Gulf Oil Lubricants India Limited
 Quality Endurance Passion
 CIN: L23203MH2008PLC267060
 Registered Office: IN Centre, 49/50, MIDC, 12th Road, Andheri (East), Mumbai - 400 093.
 Email: secretarial@gulfoil.co.in, Web site: www.gulfoilindia.com

ISSUE OF DUPLICATE SHARE CERTIFICATE

The Company has received request from following shareholder for issue of duplicate share certificate as per details mentioned below, as the original share certificate of face value of ₹ 2/- each is claimed to have been lost or misplaced and is not traceable.

Folio No.	Share Certificate No.	Distinctive No.	No. of Shares	Name of the Registered holder of the Shares
GOL0015543	15543	371581 to 371913	333	Nani C Hira

The Public are hereby warned against purchasing or dealing in any way with the above share certificate. Any persons(s) who has / have any claim(s) in respect of the said share certificate should lodge such claim(s) with the Company's Registrar and Transfer Agents, Karvy Computer Share Private Limited at Karvy Selenium Tower B, Plot No. 31 & 32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingapally, Hyderabad - 500032 and email at secretarial@gulfoil.co.in within 15 days from the date of this notice, after which no claim will be entertained and the Company will proceed to issue duplicate share certificate.

For Gulf Oil Lubricants India Limited
 Sd/-
 Vinayak Joshi
 Company Secretary & Compliance Officer
 Place : Mumbai
 Date : November 20, 2017



TALBROS AUTOMOTIVE COMPONENTS LIMITED
 CIN: L29199HR1956PLC033107
 Regd. Office: 14/1, Delhi Mathura Road, Faridabad-121003 (Haryana)
 Website: www.talbro.com, E-mail: shares@talbro.com,
 Phone No. 0129 2251482

Extract Of Unaudited Consolidated Financial Results For The Quarter And Half Year Ended September 30, 2017

Particulars	Quarter ended		Half Year ended	
	30.09.2017	30.06.2017	30.09.2017	30.09.2016
	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Total Income from Operations	16,148.27	8,859.66	8,846.49	19,067.93
Profit before exceptional items and tax	588.14	332.17	365.36	926.31
Profit before tax	803.91	332.17	365.36	1,136.08
Net Profit after tax	694.34	272.92	302.44	967.26
Total Comprehensive income for the period (Comprising profit after tax and other comprehensive income after tax)	789.01	322.98	438.86	1111.99
Per Share (Rs.)				
Earning Per Share (of Rs. 10 each) for the period - not annualised	1.234.56	1.234.56	1.234.56	1.234.56
Basic (Rs.)	5.62	2.21	2.45	7.83
Diluted (Rs.)	5.62	2.21	2.45	7.83

Note :
 1. The above is an extract of the detailed format of consolidated Financial Results for the quarter and half year ended 30th September 2017, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly/annual Financial Results and notes thereto are available on the Stock Exchange websites (www.nseindia.com & www.bseindia.com) and on Company's website www.talbro.com.
 2. The unaudited financial results and the statement of assets and liabilities were recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 21st November, 2017 and have undergone "Limited Review" by the Statutory Auditors of the Company.
 3. The Company has adopted Indian Accounting Standards (Ind AS) from 1st April, 2017 and the above financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind AS 34 "Interim Financial Reporting" prescribed under section 133 of the Companies Act, 2013, read with relevant rules issued thereunder. The date of transition to Ind AS is 1st April, 2016.
 4. Exceptional items represents profit on sale of assets under partial strategic divestment on non-core material business assets at the Sohana plant.

For Talbros Automotive Components Limited
 Sd/-
 Umesh Talwar
 Vice Chairman & Managing Director
 DIN: 00059271
 Date-21st Nov.2017
 Place- Gurugram

आन्धा बैंक ANDHRA BANK
 (A Govt. of India Undertaking)
 Satellite Branch, Shop No: 1 & 2, RJP House, Anand Nagar Road Prahlad Nagar, Satellite, Ahmedabad-380015 Phone : 079-26930553 Email : bm1153@andhrabank.co.in

POSSESSION NOTICE (RULE 8(1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002)

WHEREAS The undersigned being the Authorized Officer of Andhra Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 12-05-2017 calling upon the borrower Mr. Maulik Subhashchandra Patni and Mr. Jatin Subhashchandra Patni, to repay the amount mentioned in the notice being ₹ 23,95,320.8 (₹ Twenty Three Lakh Ninety Five Thousand Three Hundred Twenty and Eighty paise Only) within sixty days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 21st day of November of the year 2017. The borrower's attention is invited to provisions of Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured asset.

The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Andhra Bank for the amounts due from the borrower(s) and interest thereon.

DESCRIPTION OF IMMOVABLE PROPERTIES

Residential Flat belonging to Mr. Maulik Subhashchandra Patni and Mr. Jatin Subhashchandra Patni situated at Block No. B, Flat No. 403, admeasuring 82.98 Sq. Yard i.e., 69.39 Sq. Mtrs on 4th Floor, Mangalay Tower, in the land bearing T.P. Scheme No.22 of F.P. No. 29 situated at Mouje: Paldi, Taluka: City, District: Ahmedabad-4 (Paldi) and bounded by East: Flat No. 404, West: Road, North: Road, South: Road.

Date: 21.11.2017
 Place: Ahmedabad
 Chief Manager & Authorized Officer
 Andhra Bank

At & Post Bagumara, Village - Bagumara, Taluka - Palsana, Dist. Surat - 394305.
 E-mail : br.7171@syndicatebank.co.in

POSSESSION NOTICE (for Immovable properties)

Whereas, the undersigned being the authorized officer of the Syndicate Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notices to the below mentioned Borrowers / Guarantors of the property/ies to repay the amounts mentioned in the notices with further interest within 60 days of the receipt of the said notices. The borrowers / guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers / guarantor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the properties described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest Enforcement Rules 2002 on under mentioned date. The Borrowers/Guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the said property/ies and any dealing with the property/ies will be subject to the charge of **Syndicate Bank, Bagumara Branch** for amount as mentioned below with interest thereon, cost, etc. (Amount deposited after issuing of Demand Notice under section 13(2) will be given effect in due course).

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Name of Borrower/ Guarantors	Demand Notice Date & Balance Amount	Description of the Immovable Properties	Date & Type of Possession
1.	Sri Ukhadubhai P Pawar (Borrower) and Dharmendra Chhimna Nagar (Surety)	21.07.2017 Rs. 17,11,186.86 and interest thereon, costs etc.	All that part and parcel of the property consisting of Plot No. 82, Dharmannandan Residency, R.S. No. 96, Block No. 122, Village Bagumara, owned by Ukhadubhai P. Pawar within the registration sub district Palsana and District Surat. Bounded by : North : Society Road , South : Plot No. 79, East : Plot No. 81, West : Plot No. 83.	16.11.2017 Symbolic Possession
2.	Smt. Anita A Sonvane, Ashok O Sonvane (Borrowers) and Ramashankar Dudheshwar Ojha (Guarantor)	19.07.2017 Rs. 18,65,695.26 and interest thereon, costs etc.	All that part and parcel of the property consisting of Plot No. 155, Block No. 155/B, Shirididham Row House, Village Kareli, District Surat, owned by Ashok O. Sonvane, within the registration sub district Palsana and District Surat. Bounded by : North : Society Internal Road, South : Plot No. 172, East : Plot No. 156, West : Block No. 157/158.	16.11.2017 Symbolic Possession

Sd/-
Authorised Officer,
Syndicate Bank
 Date : 16.11.2017
 Place : Surat

INEOS STYROLUTION
INEOS STYROLUTION INDIA LIMITED
 Registered Office: 6th Floor, ABS Towers, Old Padra Road, Vadodara-390 007, Gujarat
 CIN: L25200GJ1973PLC002436
 Tel. No: +91 265 2303201 Fax No: +91 265 2303203
 E mail: secshare@styrolution.com | Website: www.ineosstyrolutionindia.com

Notice
For transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Suspend Account

Ministry of Corporate Affairs (MCA) had notified the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ('rules') on 05 September, 2016 providing for the transfer of the equity shares to IEPF in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more. As per the said rules, the Company had sent an individual communication dated 01 December, 2016 to those shareholders whose shares were liable to be transferred to IEPF and had not claimed the dividends for seven consecutive years starting from the financial year 2009-10 requesting them to claim the same. The Company had also uploaded the details of the shareholders whose shares were liable to be transferred to IEPF on its website viz., www.ineosstyrolutionindia.com.

Pursuant to the said rules, the Company had also published the notices in the Business Standard in english language and in Gujarat Samachar in gujarati language on 02 December, 2016, respectively.

The MCA has vide its notification dated 13 October, 2017 notified the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Second Amendment Rules, 2017. As per the amended rules, the due date for transfer of equity shares in respect of dividend which remained unclaimed / unpaid for FY 2009-10 onwards is 31 October, 2017.

The details of the shareholders whose shares are liable to be transferred to IEPF is available on the website viz. www.ineosstyrolutionindia.com

Therefore, notice is hereby given to the shareholders that the Company will proceed to initiate action for transfer of the shares of the shareholders whose dividend remained unclaimed / unpaid from FY 2009-10 onwards within 30 days from due date i.e. 31 October, 2017, without any further notice as per the amended rules.

As per the amended rules, the concerned shareholders holding the shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may please note that the Company would be issuing new share certificate(s) in lieu of the original certificate held by them for the purpose of conversion into DEMAT accounts opened by the IEPF authority with NSDL and CDSL through Punjab National Bank and SBICAP Securities Limited respectively. Upon such issue, the original share certificate(s) which are registered in your name will automatically stand cancelled and be deemed non-negotiable. In case of such shareholder holding shares in Demat form, the transfer of shares in DEMAT accounts of the IEPF Authority as indicated herein above will be effected by the Company through respective Depository by way of corporate action.

The shareholders may please note that the above full details of updated list of such shareholders uploaded by the Company on its website should be regarded and shall be deemed to be adequate notice in respect of issue of new share certificate for the purpose of transfer of shares to DEMAT accounts of the IEPF Authority pursuant to the amended rules.

Any further dividend on such shares shall be credited to the IEPF. No claim shall lie against the Company in respect of such unclaimed dividend and the shares transferred to IEPF. On transfer of the dividend and the shares to IEPF, the shareholders may claim the same by making an application to IEPF in Form IEPF- 5 as per the rules. The said form is available on the website of IEPF viz. www.iepf.gov.in.

In case the shareholders have any queries on the subject matter they may contact the undersigned as per the contact details appearing therein

By order of the Board
For Ineos Styrolution India Limited
 Sd/-
Haresh Khilnani
 Date : 21.11.2017
 Place : Vadodara
 Company Secretary, Head - Legal & Compliance

NOTICE

Declaration of Dividend under Dividend Option of Kotak Balance and under Bimonthly Dividend Option of Kotak Equity Arbitrage Fund

Notice is hereby given that Kotak Mahindra Trustee Company Limited; the Trustee to Kotak Mahindra Mutual Fund has approved declaration of dividend under the Dividend Option of Kotak Balance, an open ended balanced scheme and under bimonthly dividend option of Kotak Equity Arbitrage Fund, an open ended equity growth scheme. The details are as under:

Name of the Scheme	Quantum of dividend per unit #	Record Date	Face Value per unit	NAV as on November 20, 2017
Kotak Balance - Regular Plan - Dividend Option	Re. 0.14	November 27, 2017	Rs. 10.00	Rs. 17.0350
Kotak Balance - Direct Plan - Dividend Option	Re. 0.14			Rs. 18.3750
Kotak Equity Arbitrage Fund - Regular Plan - Bimonthly Dividend Option	Re. 0.1990	November 27, 2017	Rs. 10.00	Rs. 20.1186
Kotak Equity Arbitrage Fund - Direct Plan - Bimonthly Dividend Option	Re. 0.2171			Rs. 20.3243

Distribution of the above dividend is subject to the availability and adequacy of distributable surplus.

Pursuant to payment of dividend, the NAVs of the Dividend Option of the Schemes would fall to the extent of payout and statutory levy if any.

All Unit Holders / Beneficial Owners of the Dividend Options of the scheme, whose names appear in the records of the Registrar, Computer Age Management Services Pvt. Ltd. / Depositories as on November 27, 2017, will be eligible to receive the dividend.

For Kotak Mahindra Asset Management Company Limited
 Investment Manager - Kotak Mahindra Mutual Fund
 Sd/-
 Nitesh Shah
 Managing Director
 Mumbai
 November 21, 2017

Any queries / clarifications in this regard may be addressed to:
Kotak Mahindra Asset Management Company Limited
 CIN: U65991MH1994PLC080009
 (Investment Manager for Kotak Mahindra Mutual Fund)
 6th Floor, Kotak Towers, Building No. 21, Infinity Park, Off: Western Express Highway, Goregaon - Mulund Link Road, Malad (East), Mumbai 400097.
 Phone Number: 022 - 66056825 • Email: mutual@kotak.com • Website: assetmanagement.kotak.com
Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Form A
PUBLIC ANNOUNCEMENT
[Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016]
FOR THE ATTENTION OF THE CREDITORS OF CONCAST STEEL & POWER LIMITED

RELEVANT PARTICULARS	
1. NAME OF CORPORATE DEBTOR	CONCAST STEEL & POWER LIMITED
2. DATE OF INCORPORATION OF CORPORATE DEBTOR	08/06/1995
3. AUTHORITY UNDER WHICH CORPORATE DEBTOR IS INCORPORATED / REGISTERED	Ministry of Corporate Affairs (ROC-West Bengal)
4. CORPORATE IDENTITY NUMBER OF CORPORATE DEBTOR	U51909WB1995PLC072045
5. ADDRESS OF THE REGISTERED OFFICE AND PRINCIPAL OFFICE (IF ANY) OF CORPORATE DEBTOR	Address of the Registered & Corporate Office: 21, HEMANT BASU SARANI, 5TH FLOOR ROOM NO 511 & 512, CENTRE POINT KOLKATA WB 700001 IN Address of the place from where the Corporate Debtor conducts its Material Business Operations: Unit : Jharsuguda Industrial Growth Centre, Vill-Kukurjanga, P.O.-Badmal, Dist.-Jharsuguda, Pin: 768203, Odisha Unit : Bankura Gaurandih, P.O. Bonkati, Via Kenduadihi, Dist. Bankura, Pin: 722102, West Bengal Unit : Sodepur 2, Ishwar Chandra Chatterjee Lane, Sodepur, 24 Parganas (N), West Bengal Unit : Srikakulam Amadalavalasa (Mandal), Vill.-Dusi, Srikakulam, Pin: 534484, Andhra Pradesh Godowns Liluah Unit : 2, Mali Panchghara Street, Liluah, Howrah Dankuni Unit : Mouza Panchghara, DEH, Dankuni, Hooghly Gopalpur Unit: Gopalpur, Durgapur
6. INSOLVENCY COMMENCEMENT DATE IN RESPECT OF CORPORATE DEBTOR	07.11.2017
7. ESTIMATED DATE OF CLOSURE OF INSOLVENCY RESOLUTION PROCESS	05.05.2018
8. NAME OF THE INTERIM RESOLUTION PROFESSIONAL ADDRESS OF THE INTERIM RESOLUTION PROFESSIONAL EMAIL ADDRESS OF THE INTERIM RESOLUTION PROFESSIONAL REGISTRATION NUMBER OF THE INTERIM RESOLUTION PROFESSIONAL	SANJAY KUMAR AGARWAL CCC Asset Resolution Company LLP Draupadi Mansion, 3rd Floor, 11 Brabourne Road, Kolkata, West Bengal, 700001 concast.ir.pccarc@gmail.com IBBI/IPA-001/IP-P00062/2017-18/10140
9. LAST DATE FOR SUBMISSION OF CLAIMS	05.12.2017

Notice is hereby given that the National Company Law Tribunal, Kolkata Bench has ordered the commencement of corporate insolvency resolution process of **CONCAST STEEL & POWER LIMITED** vide order dated 07.11.2017.

The creditors of **CONCAST STEEL & POWER LIMITED**, are hereby called upon to submit proof of their claims on or before 05.12.2017 to the interim resolution professional at the address mentioned against item 8.

The financial creditors shall submit their proof of claims by electronic means only. The operational creditors, including workman(s) and employee(s), may submit their proof of claims in person, by post or electronic means. Submission of false or misleading proofs of claim shall attract penalties.

Date : 22.11.2017
 Place : Kolkata
 Sd/- **Sanjay Kumar Agarwal**
 Interim Resolution Professional



WIPRO LIMITED

Registered Office: Doddakannelli, Sarjapur Road, Bangalore - 560 035.
 Tel: +91-80-2844 0011; Fax : +91-80-2844 0054
 CIN No. L32102KA1945PLC020800
 Email: corp-secretarial@wipro.com Website: www.wipro.com

NOTICE

(For the attention of the Equity Shareholders of the Company)

Mandatory transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF)

This notice is published pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") as amended.

In accordance with the requirements as set out in the Rules, the Shares in respect of Dividend declared for the Financial Year 2009-10 which remained unclaimed for seven consecutive years are being transferred to Investor Education and Protection Fund (IEPF). The details of Shares liable for transfer to IEPF is made available in our Company's website www.wipro.com/investors for reference.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed Dividend amount and Shares transferred to IEPF pursuant to the Rules.

Shareholders who desire to claim above mentioned Shares from IEPF Authority, you may follow the procedure as outlined in Rule 7 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.

In case of any queries, please contact the Company or the Registrar and Share Transfer Agent - Karvy Computershare Private Limited at their following address/email/telephone number.

Wipro Limited,
Doddakannelli,
Sarjapur Road,
Bangalore- 560 035.
Telephone: +91 80 2844 0011
(Extn: 226183, 228053 and 226128)
Fax: +91 80 2844 0054
Email: corp-secretarial@wipro.com
Website: www.wipro.com

Karvy Computershare Pvt. Ltd.,
Unit: Wipro Limited,
Karvy Selenium Tower B, Plot no. 31-32,
Gachibowli, Financial District,
Nanakramguda, Hyderabad- 500 032.
Telephone: 040 6716 2222
Toll free no: 1800-3454-001
Fax: 040-2300 1153
Email: einward.ris@karvy.com
Website: www.karvycomputershare.com

For WIPRO LIMITED
 Place: Bangalore, India
 Date: November 21, 2017
 Company Secretary

